

## સોહમુ

— લતા હિરાણી

એક મિઠો છોકરો. એનું નામ સોહમુ.

સોહમુને બગીચામાં ફરવું ગમે. ભાતભાતનાં પંખી જોવાં ગમે. જાતજાતનાં વૃક્ષો પાસે રમવું ગમે. રંગબેરંગી પતંગિયાંને જોવાં ગમે. જાતજાતનાં વૃક્ષો પાસે રમવું ગમે. રંગબેરંગી પતંગિયાંને જોઈ એ ગેલમાં આવી જાય.

“મમ્મી મમ્મી આ પતંગિયું અપાવ ને ! મારે જોઈએ છે.”

“શું કરવું છે તારે પતંગિયાને ?”

“મમ્મી, મારા બિસ્સામાં રાખીશ. મન થશે ત્યારે એની સાથે રમીશ. એની પાંખો કેવી મજાની છે ! તું કલરબોક્સ લાવે છે એના રંગ પણ આવા સરસ નથી.”

“જો બેટા, પતંગિયાંને પકડવાં યોગ્ય નથી . એને તો ઊડવું જ ગમે. પકડીએ તો બિચારું ગૂંગળાઈને મરી જાય. તને કોઈ પકડીને પૂરી ઢે તો તને ગમે ?”

“ના, હો !”

“તો પછી પતંગિયાને ક્યાંથી ગમે ? તું જેમ દોડાઢોડી કરે છે એમ પતંગિયું ઊડાઉિડ કરે. એને જોવાય અને ખુશ થવાય.”

સોહમુ મમ્મીની વાત માની જાય, પણ બગીચામાંથી ખસે નહીં. મમ્મી બૂમો માર્યા કરે તોયે ઘરમાં જાય નહીં.

એક વાર સોહમુ એનાં ફોઈને ઘેર રહેવા ગયો હતો. ફોઈના ઘરે બાલકનીમાં કેટલાંય કૂડાં હતાં. કૂડાંમાં કેટલાક છોડ વાવ્યા હતા. સોહમુને બગીચો નાનો લાગ્યો. એના ઘરે મોટો બગીચો હતો, પણ પછી એ રમવા લાગ્યો. એવામાં એણે એક કૂડાંમાં બે ઈડા જોયાં.

એ દોડતો દોડતો ફોઈ પાસે આવ્યો. ફોઈ અને મમ્મી વાતો કરતાં હતાં. “ફીઆ ફીઆ, આ કૂડામાં શું છે ?”

ફોઈએ ઉભા થઈને જોયું. “અરે, વળી કબૂતરે અહીં ઈડા મૂક્યાં ?”

પછી મમ્મી તરફ ફરીને કહે,

“આ કબૂતર અહીં વારે વારે ઈડા મૂકે છે. પછી જ્યાં સુધી ઈડા ફૂટે નહીં, બચ્ચાં બહાર આવે નહીં ત્યાં સુધી આપણે એને રહેવા દેવાં પડે. કબૂતર બધું ગંદુ ગંદુ કરી નાખે છે. બાલકનીમાં બેસવા જેવું રહેવા નથી દેતાં. વળી, બચ્ચાં થાય પછી બિલાડી આવીને ખાઈ જાય છે. આપણે ઓછાં આખો દિવસ ધ્યાન રાખી શકીએ !”

મમ્મી કહે, “સાચી વાત. બિલાડી ખાઈ જાય તો બહુ દુઃખ થાય.”

એવામાં ઝોઈના દીકરા સૌરીને સોહમુને બોલાવ્યો. સોહમુ અંદર ગયો. અંદર ડાઈનિંગ ટેબલ પર બેસીને સોહમુ અને સૌરીન બન્નેએ નાસ્તો કર્યો. સોહમુ વળી રમવા માટે બાલકનીમાં ગયો.



કૂતુહલથી એ કૂડા પાસે ગયો. કૂંઠું તો હતું, ઈડા ક્યાં ક્યા ગયાં ? બિલાડી આવીને ખાઈ નહીં ગઈ હોય ને !

એ દોડતો દોડતો ફીઆ પાસે ગયો. “ફીઆ, પેલાં ઈડા ક્યાં ?”

“એ તો મેં કાઢી નાખ્યાં.”

ક્યાં કાઢી નાખ્યાં ?”

“બહાર ફેંકી દીધાં.”

સોહમુ થીલોટ્સ થઈ ગયો. ફેબા અને મમ્મીનું એના તરફ ધ્યાન નહોતું. તેઓ વાતો કરતાં કરતાં રસોડામાં ગયાં. થોડી વાર પછી તેઓ બહાર આવ્યાં ત્યારે સોહમુ નીચે ઝોઈને બાલકનીમાં એક ખૂણામાં બેઠો હતો. એનું મોં પડી ગયું હતું.

મમ્મી એની પાસે આવ્યા. “શું થયું બેટા ?”

સોહમે મમ્મી સામે ન જોયું. મમ્મીએ એનું મોં ઊંચું કર્યું. જોયું તો સોહમું રડતો હતો.

“શું થયું બેટા ?”

સોહમું હીબકાં ભરીને રડવા લાગ્યો. ત્યાં ફોઈ પણ આવી પહોંચ્યાં. “શું થયું સોહમુને ?”  
સોહમે રડ્યે રાખ્યું. “કંઈ બોલ તો ખરો, બેટા.”

સોહમું માંડ માંડ બોલ્યો, “ઈડાંની મા ક્યારની અહીં ઊડાઉડ કરે છે. એનાં બચ્ચાંને શોધે છે.  
તમે કેમ એનાં ઈડા ફેંકી દીધાં ?”

ફોઈ તાજુબ થઈ ગયાં. એમને પોતાની ભૂલ સમજાઈ. સોહમુને ખોળામાં જેંચ્યો. એના બરડે  
પંપાળતાં પંપાળતાં કહે, “બેટા, કાન પકડ્યા. હવે કદ્દી ઈડા નહીં ફેંકી દઉં. ભલે ને ગમે તેવું ગંદું કરે.  
બિલાડી ખાઈ જાય કે જે થવાનું હોય તે થાય, પણ ઈડાં હઠાવીશ નહીં.”

મમ્મી કહે, “ના, એમ નહીં, કહો કે બિલાડીથી પણ ધ્યાન રાખીશ.”

ફોઈ કહે, “હા, એમ જ.” સોહમું મમ્મી અને ફોઈ બન્નેને તેમના ગળે હાથ વીંટાળીને ભેટી  
પડ્યો. ■